



“એક પગલું  
પ્રગતિશીલ  
પેરન્ટીંગ તરફ...”

# ખેદનટોઝોજી

## હાથીની માન્યતા

### કરો ભવિષ્ય માટે તૈયાર

નાના બાળ પર છે ભણતરનો ભાર  
આખરે કોણ છે કસૂરવાર!  
કંટાળો આવે ને ટીવી જોવું તો,  
મમ્મી વઢે વારંવાર...  
કહું છું, બસ જોવા દે થોડી વાર,  
ત્યાં તો મમ્મી વરસાવે માર.  
સાંજ પડે ત્યારે પણ્ણા આવે,  
પૂછે સવાલ લગાતાર!  
એક પછી બીજું ને એનાય પછી ત્રીજું,  
એમ ચાલે ટ્યૂશનની ભરમાર.  
કેમ સમજાવું મમ્મી—પણ્ણાને,  
મારે જોઈએ છે તમારો ઘાર  
એક નહીં સો વાર...  
આવી જાય સરપ્રાઈઝ ટેસ્ટ,  
પ્રાઈઝ ન આવે એકેય વાર,  
ચિંતા, હતાશા ને નિરાશા,  
બાળપણ બન્યું મારું બેકાર  
વાયવા ને ગોખવા કરું ઉજાગરા  
તોય રિઝલ્ટમાં ન આવે ભલીવાર...  
સતત વઢતા મમ્મી—પણ્ણાને,  
આપું છું એક લલકાર,  
વાચી મારી ચોપડીને,  
પાસ થઈ બતાવો એક વાર!  
ઈતિહાસ, ભૂગોળ છોડીને મને,  
કોઈ તો કરો ભવિષ્ય માટે તૈયાર.  
— પરીક્ષિત જોબનપુત્રા

હું હાથીઓના ટોળા પાસેથી પસાર થઈ રહ્યો હતો અને અચાનક થોભી ગયો. કારણ મેં જોયું કે આ આવડાં મોટાં પ્રાણીઓને તેમના આગળના પગે બાંધેલી એક નાનકડી દોરી માત્રથી કેદ કર્યા હતા. ન હતી કોઈ સાંકળ કે ન હતાં કોઈ પાંજરાં, આ જોઈને મને ખૂબ નવાઈ લાગી ને વિચાર આવ્યો કે હાથીઓ ગમે તે ઘડીએ ઈચ્છે તો પેલી નાનકડી દોરી તોડીને ભાગી જઈ શકે તેમ હતાં, પણ કોઈક કારણસર તેઓ તેમ કરતાન ન હતાં.

મેં ત્યાં નજીકમાં મહાવતને જોયો અને તેને પૂછ્યું કે શા માટે આ સુંદર અને શક્તિશાળી પ્રાણી આટલી શાંતિથી અહીં ઊભાં રહે છે. ભાગી જવાનો પ્રયત્ન પણ કરતાં નથી?

મહાવતે જવાબ આવ્યો, “એમાં એવું છે ને કે જ્યારે આ હાથી ખૂબ નાની વયના હોય છે ત્યારે અમે તેમના પગમાં આ નાનકડી દોરી બાંધતા હોઈએ છીએ જે એ સમયે તેમને બંધી બનાવી રાખવા માટે પૂરતી હોય છે, પણ પછી જેમ જેમ હાથી મોટા થતા જાય છે તેમ તેમ તેમના મનમાં એવી ગ્રંથિ બંધાઈ જાય છે કે તેઓ કયારેય આ દોરી તોડી શકશે નહીં. આથી તેઓ દોરી તોડીને ભાગવા વિષે વિચાર સુધ્યાં કરતાં નથી.”

મને ખૂબ આશ્વર્ય થયું. આ વિશાળકાય પ્રાણીઓ જ્યારે ઈચ્છે ત્યારે પોતાની બેરીઓ તોડી આજાદ થઈ શકે એમ હતા. પણ તેઓ એમ માનતાં હતાં કે પોતે એમ કરી શકવા સક્ષમ નથી. આથી તેઓ ત્યાંનાં ત્યાં જ કેદ થઈ ઊભાં રહેતા હતાં —વર્ષોના વર્ષોના સુધી.

ક્યાંક આપકામાંના કેટલાક પણ આ હાથીઓની જેમ જ ફક્ત પહેલાં મળેલી એકાદી નિષ્ઠળતાવશ, એકાદી ગેરમાન્યતા કે ગ્રંથિથી પ્રેરાયેલું જીવન તો નથી જીવી રહ્યાં ને?

— વિકાસ નાયક



## સો શિક્ષક બરાબર એક માતા

માતાનાં હાથમાં ઉછેરાતું બાળક સાક્ષાત ઈશ્વરના હાથે જ ઉછેરાતું બાળક ! બાળક માતા પાસેથી જેટલું શીખે છે એટલું ભાગ્યે જ કોઈ પાસેથી શીખે છે.

**માતા તરીકે બાળકનાં ઘડતર માટે આટલું જરૂર વિચારીએ.**

— બાળકનાં વર્તમાન સમજણ સાથે સુટેવ પાડીએ. બાળકને વડીલો પ્રેયેક આદર, અન્ય સાથે બોલવાની, રીત-ભાત, બેસવાની, ચાલવાની, વગેરે સુટેવો બાળકમાં શ્રેષ્ઠ વર્તનનું નિર્માણ કરશે.

— બાળકનાં સારા વ્યક્તિત્વનું નિર્માણ થાય તે માટે સારા વિચાર તેમજ ઉત્તમ પુસ્તકો વાંચવાની ટેવ પણ પાડવી જોઈએ.

— બાળકનાં સ્વાસ્થ્ય બાબતે સંપૂર્ણ કાળજી બાળકનાં યોગ્ય વિકાસનું પાસું છે. બાળકને પોષણાક્ષમ આહાર પ્રાપ્ત થાય તે મુજબ બાળકના ખાન-પાનથી ગોઠવણી કરવી જોઈએ. દા.ન. સન્નાદમાં એક દિવસ ફળ, એક દિવસ કઠોળ, એક દિવક સલાદ, એક દિવસ પૌણ્ટિક ફરસાણ રાખી શકાય. બાળકનાં સાંજના નાસ્તામાં અને ધરનાં ભોજનમાં સ્વાદની સાથે માતાની લાગજી ભણે પણી પૂછવું જ શું !

— ‘બાળકની ભૂલ માટે ટકોર કરો ટક-ટક નહીં’. બાળકને સમજવાનો પ્રયત્ન કરી ભૂલને સમજાવી સમાધાન લાવવું જોઈએ.

— બાળકને રમવાની વ્યવસ્થા ગોઠવી તેનાં શારીરિક વિકાસ માટે સભાન બનવું જોઈએ. વિવિધ રમતો થકી બાળકના વિકાસમાં માની ન શકાય એટલો વિકાસ સંભવ છે. હાર-જીત પ્રત્યે સભાન અને સહકારની ભાવના વિકસે છે. આનંદ, ઉત્સાહ અને ધ્યેયપ્રાપ્તિ માટેનાં ગુણો સ્વબળો તેનામાં આવે છે. બાળકને રમત-ગમત માટે થોડો છૂટો મુકવો પડે તો પણ કાળજીપૂર્વક એમ કરવું જ જોઈએ

— બાળકને સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં જોડવાની પહેલ કરો. શાળાની તેમજ અન્ય સંસ્થાની વિવિધ બાળબક્ષી ઈતર પ્રવૃત્તિમાં બાળકની રસ-વૃત્તિ આપ મેળે ભીલે છે માતાએ બાળકની રસ-રૂચી જાગી તે મુજબ યોગ્ય વ્યવસ્થા ગોઠવી આપવી જોઈએ. ચિત્ર, ડાન્સ, ગાયન, લેખન, વક્તુત્વ, રમત-ગમત, વાદન વગેરે રસની પ્રવૃત્તિને શ્રેષ્ઠ બનાવવા મદદરૂપ બનો.

— બાળકનાં સામાજિક સાતત્ય માટે સમાજ ભાવનાં કેળવવા જરૂર પ્રયત્ન કરો. સગા-સંબંધી, પરિવારમાં પ્રસંગો-પ્રસંગો હાજરીમાં બાળકનું આગમન સમાજમાં તેના હિસ્સાની પ્રતીતિ કરાવશે. લોકો વચ્ચે બોલવાની કણા, વાત કરવાની તેમજ રજુઆત કરવાની કણા શીખવવી જોઈએ.

— બાળકને જ્ઞાનમાં મશકરી કરીને ઉતારી પાડવાની ભૂલ કરારેય ન કરશો. બાળક નાની મોટી જવાબદારી પ્રત્યેક જાગૃત બને તે માટે ધરનાં વ્યાખ્યામાં તેમજ વસ્તુઓની ખરીદીના કાર્ય બાળકને સોંપી શકાય છે. આવી પ્રવૃત્તિથી બાળકનો ચૈતસિક, માનસિક વિકાસ ચોક્કસ થશે.

— બાળકની કુતૂહલવૃત્તિ અને પ્રશ્નોને ચૂપ કરાવવાને બદલે બાળકની વાત સાંભળીને બાળકના પ્રશ્નોનું નિરાકરણ અવશ્ય કરો. ધણા પરિવારનાં બાળકોને આ રીતે વાંરવાર પ્રશ્નો પૂછવાની ટેવ હોય છે. પરતું ધણા પરિવારના માતા-પિતા કે વડીલો બાળકને રીતસર ધમકાવી નાખે છે. પરિવારનાં કેટલાક સભ્યો આવા બાળકોને ‘કવેશ્યનમાર્ક’ જેવા હુલામણા નામથી સંબોધી બાળકની જ્ઞાસાને ખતમ કરી નાખે છે.

— બાળકને ધરની સ્થિતિ અને પરિસ્થિતિથી વાકેફ કરવો ખૂબ જરૂરી છે. સુખ અને દુઃખ જેવી પરિસ્થિતિમાં સમજણાભરી હુંક ધરની સ્થિતિ પ્રત્યે ખુલ્લા મને વાત કરવાથી એની સંવેદના વધુ જાગૃત થશે. પિતાની મહેનત, દાદાની મહેનત તથા માતા અને દાદીનું ધરમાં કાર્ય કરવું. આવી અનેક બાબતો એનામાં પરિવાર ભાવના પ્રગટ કરશે.

— બાળકની જીદને સમજીને પૂર્ણ કરો. બાળક જે વસ્તુ માગે તે તરત પૂર્ણ ન કરો. વસ્તુનું મહત્વ અને ઉપયોગ વિશે સમજ આપો અને હા, જન્મદિવસ કે બાળકની સફળતા સમયે એને જરૂરી વસ્તુઓ ભેટ આપી રાજી પણ કરો ! બાળકની જીદ એની વાત મનાવવાનું કરણ બને તે પણ એક મોટો પડકાર જ છે ને ! આ મુદ્દે માતાએ મન પર અંકુશ રાખીને કાર્ય કરવાનું છે. બાળકના અભ્યાસમાં મદદરૂપ બનો. બાળકના ગૃહકાર્યને સામે બેસીને એના અક્ષર, એનું લખાણ વગેરે બાબતે ધ્યાન રાખો. જરૂર પડ્યે માર્ગદર્શન આપો. શાળા, શિક્ષકોનાં સંપર્કમાં રહો. અભ્યાસ બાબતે ચર્ચા કરો બાળકના સબળા અને નબળા વિષયને જાગીને તે બાબતે સજાગ બનો. બાળકના અભ્યાસમાં પ્રેશર આપવાને બદલે પ્રેરક બનો. બીજા વિદ્યાર્થીઓની ક્ષમતા સાથે પોતાનાં બાળકની તુલના કરવી એ સૌથી વધુ ભયજનક ગણી શકાય. બાળકના માતા-પિતા પોતાના સપનાને નહીં પરંતુ બાળકનાં સપનાને હકીકતમાં બદલવા પ્રયત્ન કરે તો બાળકની આવતીકાલ શ્રેષ્ઠ બની શકે.

પુસ્તક: ઉત્તમ વાલી સર્વોત્તમ સંતાન  
— ગીતાબેન ગાજીપરા

બિલ ગેટ્સ તાજેતરમાં એક ઉચ્ચ માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓ કરી ૧૧ બાબતો શીખતા નથી જે જીવન માટે શિખવી ખૂબ ઉપયોગી છે. એ વિષે વક્તવ્ય આપું.

**નિયમ ૧:** જીવન તમે ધારો છો એટલું સરળ અને સરસ નથી એ હકીકત સ્વીકારી લો. એનાથી ટેવાઈ જાઓ.

**નિયમ ૨:** દુનિયા તમારા સ્વમાનની પરવા કરશે નહીં. દુનિયા ઈચ્છશો કે તમે તમારી જીત વિશે સારું માનતા થાઓ એ પહેલાં કંઈક સારું કરી દેખાડો.

**નિયમ ૩ :** તમે શાળામાંથી બહાર નીકળતાં જ વર્ષના ૫૦,૦૦૦ ડોલર કમાઈ શકવાના નથી. તમે કોઈ કંપનીના ઉચ્ચ હોટેદાર બની ગાડીમાં ફરવા લાયક તરત નહીં બની જાઓ, ત્યાં સુધી પહોંચવા માટે તમારે તેને લાયક બનવું પડશે.

**નિયમ ૪ :** જો તમે માનતા હોઈ કે તમારા શિક્ષક કડક છે. તો તમારાં બોસ વિષે તો તમે શું વિચારશો?

**નિયમ ૫ :** કોઈ રેસ્ટોરન્ટમાં બર્ગર પીરસવા એ કંઈ નાનપણું કામ નથી. કોઈ કામ નારું હોતું નથી. દરેક કામમાં તક જોતા શીખો.

**નિયમ ૬ :** જો તમે કંઈક ગરભડ કરો તો તેનો ગુસ્સો તમારાં માતા-પિતા પર ઉતારતા હોવા છો જે ખોટું છે. તમારી ગરભડમાં એમનો શું વાક ? આથી ખોટો ગુસ્સો ન કરતાં દરેક ભૂલમાંથી કંઈક શીખો.

**નિયમ ૭ :** તમે જન્મ્યા ન હતા ત્યાં સુધી તમારાં માતા પિતા અત્યારે છે એટલાં નિરુત્સાહી અને કંટાળાજનક ન હતાં, પણ તમારા પાછળ ગજાબહારના ખર્ચાઓ કરી. તમારાં કપડા ધોઈ ધોઈને તમારી ગાંડાધેલી વાતો સાંભળી સાંભળીને તેઓ આજે છે તેવાં બની ગયા છે. આથી તમારાં માતા પિતાની પેઢી વિશે ઘસાતું બોલવાનું તરત બંધ કરી દેજો. તેમને માન આપતાં શીખજો.

**નિયમ ૮ :** તમારી શાળામાં કદાચ વિજેતા અને નિષ્ફળ વ્યક્તિ વચ્ચે ભેટ નહીં કરતો હોય પણ બહારના વિશ્વમાં એવું નથી. ધારી શાળાઓમાં નાપાસ કરતાં જ હોતા નથી અને તમને જે નથી સમજતું કે આવડતું તે વારંવાર શિખવવામાં આવતું હોય છે, પણ બહારના વિશ્વમાં આનાથી તદ્દન વિપરીત પરિસ્થિત હોય છે.

**નિયમ ૯ :** જીવન શાળાના સત્તોની જેમ મહિનાઓમાં વહેંચાયેલું હોતું નથી કે એમાં તમને ઉનાળાનું વેકેશન પણ મળતું નથી. ઘણા ઓછા નોકરી આપનારા માલિકોને તેમના કર્મચારીઓમાં કે તેમના વિકાસમાં રસ હોય છે. એ માટે તમારે પોતે જ સંધર્ષ કરવો પડશે.

**નિયમ ૧૦ :** વાસ્તવિક જીવન કરી ટી.વી. કે તેના પર દેખાડાતા કાર્યક્રમ એટલું સરળ અને સુંદર નથી હોતું.

**નિયમ ૧૧ :** ખરાબમાં ખરાબ માણસ સાથે પણ સારી રીતે વર્તન કરતાં શીખો. શક્ય છે તેમાંના એકાદ સાથે જ કે એકાદના હાથ નીચે જ તમારે કામ કરવું પડે!

— પુસ્તક : આભૂપણ (લેખક – વિકાસ નાયક)

## સર્વાઈવલ કીટ

‘સર્વાઈવલ કીટ’ એટલે ટકી રહેવા માટે (કે જીવન ટકાવી રાખવા માટે) જરૂરી સાધનસામગ્રીનો સમૂહ.

રોજબરોજ માટે જીવનોપયોગી ‘સર્વાઈવલ કીટ’માં સમાવિષ્ટ ચીજ – વસ્તુઓની યાદી :

૧. ટ્રૂથપિક
૨. રબ્બર બેન્ડ
૩. બેન્ડએઝિડ
૪. પેન્સિલ
૫. લખેલું ભૂંસવાનું રબર
૬. ચ્યુર્ઝિંગ-ગમ
૭. મિન્ટ
૮. કેન્ડી કિસ
૯. ચાની પોટલી

શા માટે? આવો જોઈએ :

(૧) ટ્રૂથપિક : તમને બીજાઓના સારા ગુણો અલગ તારવી કાઢવાનું યાદ અપાવવા માટે.

(૨) રબ્બર બેન્ડ : તમને સ્થિતિસ્થાપકતાનો ગુણ શીખવવા. જીવનમાં બધું જ તમારા ધાર્યા પ્રમાણે થતું નથી. તમારે ફેલકસીખલ રહેતા શીખવું જોઈએ.

(૩) બેન્ડએઝિડ : તમને તમારાં પોતાના ને બીજાઓનાં જ્ઞામ રૂઝાવવાનું યાદ અપાવવા માટે.

(૪) પેન્સિલ : તમારી સાથે રહેલી શુભકામનાઓની યાદી બનાવવા માટે.

(૫) લખેલું ભૂંસવાનું રબર : તમને યાદ અપાવવા માટે કે બધાથી ભૂલો થતી હોય છે અને તે સુધારી શકાય છે.

(૬) ચ્યુર્ઝિંગ-ગમ : તમને (તમારા ધ્યેય સાથે) વળગી રહેવાનો નિયમ શીખવવા માટે.

(૭) મિન્ટ : તમને યાદ અપાવવા માટે કે તમારી કિંમત મિન્ટ જેટલી છે (તમારું મૂલ્ય કર્યારેય ઓછું ન આંકશો)

(૮) કેન્ડી કિસ : તમને યાદ અપાવવા કે દરેક જીણ સાથે પ્રેમપૂર્વક વર્તાવું જોઈએ. પોતાનાંને આલિંગન અને આદર રોજ આપવાં જોઈએ.

(૯) ચાની પોટલી : રોજ તાજા રહેવાનું યાદ અપાવવા માટે.

જીવનમાં હકારાત્મક અભિગમ કેળવી (તમારી પાસે) શું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

શબ્દ દ્રારા અપાયેલો જ્ઞામ પણ શારીરિક ઘા જેટલો જ ઊડો અને પીડાદાયી હોય છે.

મિત્રો સાચાં રત્નો સમાન છે. તેઓ તમને સ્વિત સહ જીવનમાં આગળ વધવાનું અને સક્રિય થવાનું બળ આપે છે. તેઓ તમારી વાતો ધ્યાનથી સાંભળો છે, તેમની વાત તમારી સમજ રજૂ કરે છે. જરૂરી હોય ત્યાં તમારાં વખાણ કરી તમને પ્રોત્સાહન આપે છે.

# લોકસાહિત્યકાર સાંઈરામ દવેના પેરનિટંગ સોલ્યુશન...

શું આપના બાળકને ચશ્માં આવી ગયા છે. ?

માતા-પિતા તરીકે નિયેના પ્રશ્નો પોતાની જતને પુછીએ.

■ શું તમારું બાળક અડધા કલાકથી વધુ ટીવી જૂએ છે?

■ શું બાળક દસ ફૂટથી ઓછા અંતરે બેસીને ટીવી જૂએ છે.

■ શું ચશ્માંનું કારણ આનુવંશિક છે?

■ તેનાં બેડરૂમ કે સ્ટડીરૂમમાં પૂરતી લાઈટ્સ છે?

■ શું એ લીલાં શાકભાજ ભરપૂર ખાય છે?

■ શું બાળક શીર્ષાસન કે પ્રાણાયામ જાણે છે અને તે રોજ કરે છે?

## સાંઈ ટિપ્સ

- ❖ રાતે રૂમમાં અંધારામાં ટીવી કે મોબાઇલનો ઉપયોગ ન જ કરો.
- ❖ શહેરના શ્રેષ્ઠ EYE સર્જનની બાળકને મુલાકાત કરાવો.
- ❖ આંખ સતેજ કરવાના આયુર્વેદિક ઉપચારોનો ઘરમાં અમલ કરો અને બાળક ચશ્માના અપરાધ ભાવથી પીડાય નહીં એની ખાસ તક્કેદી રાખો.
- ❖ બાળકને કહો, ચશ્માં પહેરવા એ કોઈ ગુનો નથી. પૂ. મોરારિબાપુથી માંડીને વડાપ્રધાન નરેન્દ્ર મોહી સુધી બધા ચશ્માં પહેરે જ છે બેટા ! રિલેક્ઝન.... !
- ❖ આંખો નબળી હોઈ શકે, પણ જીવનનું લક્ષ્ય નબળું ન હોવું જોઈએ.' આ સૂત્ર બાળકના માનસપટ પર છાપી દો.



શું આપનું બાળક સવારે ઊઠવામાં ખૂબ આગસ કરે છે ?

માતા-પિતા તરીકે નિયેના પ્રશ્નો પોતાની જતને પુછીએ.

■ શું તમે બાળપણમાં ઉત્ત્પ દિવસ રોજ વહેલા ઊઠતા હતા?

■ સાત કલાકની ઊધ બાળકને મળવી ફરજિયાત છે. શું તમારા બાળકને એ મળે છે?

■ સવારની સ્કૂલ હોય તો બપોરે તમે તેને ઊધવા દો છો ?

■ રાતે સૂતા સમયે તેને મોબાઇલ આઇપેડ વગેરે રમવા આપો છો ?

■ રાતે તમે તેને ગુરુસે થઈને સૂવડાવો છો?

■ પરીક્ષા કે ટેસ્ટના ભયથી તે વહેલા ઊઠવાનું ટાળે છે એ તપાસું ?

## સાંઈ ટિપ્સ

❖ બાળકનું રાતે સૂર્ય જવાનું ફિક્સ અને કડક સમયપત્રક બનાવો અને એનું પાલન કરો.

❖ ગુડ લુકિંગ, હેન્સમ અને હેલ્થી થવા માટે વહેલા ઊઠવું ખૂબ જરૂરી છે. આ વાત બાળકને દઢ કરાવો.

❖ રાતે હોમવર્ક કરી લે પછી તેની સાથે દસ મિનિટ રમો, મસ્તી કરો.

❖ બાળક જેને રોલ મોડલ માનતું હોય એ તમામ વહેલા ઊઠે છે માટે જ સફળ છે. આ વાત એને ગળે ઉતારો.

❖ આલાર્મ કે ગુરુસાથી જગાડવાને બદલે તેના માથે હાથ મૂકી ગીતની કરીથી કયારેક જગાડો. તેને ભેટીને સવારમાં ગદગદિયા કરો, પછી જૂઽાં મજા... !



## VASISHTHA GROUP OF SCHOOL

### શ્રી વસિષ્ઠ પિંડાતાય, વાડ.

ગુજરાતી માદ્યમ / ડિલ્ભાષી માદ્યમ

નર્સરી થી ધો. ૧૨ સાયન્સ/કોર્મર્સ

૦ 02621 255551/3 © 91734 02809 / 91733 15555

### વસિષ્ઠ જેનેસિસ સ્કૂલ, બાબેન.

ગુજરાતી માદ્યમ

ધો. ૧ થી ૧૨ સાયન્સ/કોર્મર્સ

૦ 02622 225542/43 © 91576 44555

www.vasishthagensisschool.net